

## કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આ.કૃ.યુ., દેવાતજ દ્વારા મીઠાપાણીમાં મત્સ્ય ઉછેર પર પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, દેવાતજ દ્વારા તા. ૦૧ થી ૦૫ ફેબ્રુઆરી, ૨૦૨૨ દરમિયાન “મીઠાપાણીમાં મત્સ્ય ઉછેર” વિષય પર અનિકેત ખેડુત છત્રાલય, બોરસદ ચોકડી પાસે, આણંદ ખાતે પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આણંદ, વડોદરા, અમદાવાદ, સુરત, મહિસાગર, ખેડા, ભરુચ, ભાવનગર અને બોટાદ જિલ્લાના કુલ મળી ૨૩ જેટલા ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ.

કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે ડો. એમ. એન. બ્રહ્મભટ્ટ, આચાર્ય અને ડીનશ્રી, વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, આણંદ તેમજ શ્રી. આર. પી. સખરેલીયા, નાયબ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી, સુરત અતિથી તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં કે.વિ.કે., દેવાતજના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાશ્રી ડો. એ. સી. વૈદ્ય દ્વારા હાજર સૌનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ. ડો. એમ. એન. બ્રહ્મભટ્ટ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે હાલના સમયમાં મત્સ્ય ઉછેર એવો વ્યવસાય છે જેના થકી મત્સ્યખેડૂતો, ગ્રામીણ યુવાનો-યુવતીઓ અને ઉદ્યોગસાહસિકો આત્મનિર્ભર બની સામાજિક અને આર્થિક વિકાસની સાથે સાથે રોજગારીની તકો ઉભી કરી શકે છે. વૈજ્ઞાનિક રીતે મત્સ્ય ઉછેર અને તેને લગતી પ્રવૃત્તિઓનું યોગ્ય માર્ગદર્શન મેળવવા આ પ્રકારના તાલીમ કાર્યક્રમોમાં ભાગ લેવો ખુબ જરૂરી છે. શ્રી. આર. પી. સખરેલીયા સાહેબે ગુજરાતમાં મીઠા પાણીના મત્સ્ય ઉછેરની હાલની પરિસ્થિતિ તેમજ મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા ચાલતી પ્રવૃત્તિઓ અંગે સૌને માહિતી આપેલ.

આ તાલીમમાં વિવિધ તજજ્ઞો દ્વારા પાંચ દિવસ દરમિયાન મીઠા પાણીના મત્સ્ય ઉછેરને લગતી વિવિધ પદ્ધતિઓ જેવી કે મત્સ્ય ઉછેર તળાવની રચના અને બાંધકામ, મત્સ્ય બિયારણનું ઉત્પાદન અને તેની ઉછેર પદ્ધતિઓ, મિશ્ર મત્સ્ય ઉછેર, મીઠા પાણીના ઝિંગાનો ઉછેર, ખોરાકનું વ્યવસ્થાપન, સંકલીત મત્સ્ય ઉછેર, પાંજરા અને પેનમાં મત્સ્ય ઉછેર તથા રાજ્ય સરકારની મત્સ્યઉછેર માટેની વિવિધ યોજનાઓ વગેરે પર થીયરી તેમજ પ્રેક્ટીકલ દ્વારા સમજણ આપવામાં આવેલ.

તાલીમના અંતે તાલીમાર્થીઓને સર્ટીફિકેટનું વિતરણ કરવામાં આવેલ. આ તાલીમ કાર્યક્રમનું સમ્પૂર્ણ આયોજન તેમજ સંચાલન શ્રી જે. એચ. ભટ્ટ, વૈજ્ઞાનિક (ફીશરીઝ), કે.વિ.કે., દેવાતજ દ્વારા કરવામાં આવ્યું હતું.



